

G R INFRAPROJECTS LIMITED

(Formerly known as G.R. Agarwal Builders and Developers Limited)

CIN: L45201GJ1995PLC098652

10th August 2022

To

BSE Limited
Phiroze Jeejeebhoy Towers
Dalal Street, Fort
Mumbai – 400001

Scrip Code: 543317

National Stock Exchange of India Limited

Exchange Plaza, Plot No. C-1 G Block, Bandra-Kurla Complex, Bandra(E) Mumbai -400051

Symbol: GRINFRA

Sub: Submission of Newspaper Publication of the Financial Results for the quarter ended

30th June 2022.

Dear Sir,

Pursuant to provisions of Regulation 30 and Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclose herewith copies of the newspaper advertisements, pertaining to the unaudited standalone and consolidated financial results of the Company for the quarter ended 30th June 2022, published in Financial Express, English edition and Financial Express, Gujarati edition on 10th August 2022.

Request you to kindly take the same on record.

Thanking you,

Yours sincerely,

For G R Infraprojects Limited

Sudhir Mutha
Company Secretary

ICSI Membership No. ACS18857

Enclose: As above.

Email: info@grinfra.com | Website: www.grinfra.com



G R INFRAPROJECTS LIMITED

Registered Office: Revenue Block No.223, Old survey No. 384/1, 384/2, Paiki and 384/3, Khata No.464, Kochariya, Ahmedabad, Gujarat - 382220 Corporate Office: 2nd Floor, Novus Tower, Plot No. 18, Sector -18, Gurugram, Haryana- 122015 CIN: L45201GJ1995PLC098652, Ph: +91 124-6435000

Website: www.grinfra.com, Email: cs@grinfra.com
EXTRACT OF THE STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2022

SL.	Particulars :	Standalone				(Rupees in lakhs, except per share data Consolidated			
No.		Quarter ended			Year ended	Quarter ended			Year ended
		30 June 2022 (Unaudited)	31 Mar 2022 (Audited)	30 June 2021 (Unaudited)	31 March 2022 (Audited)	30 June 2022 (Unaudited)	31 Mar 2022 (Audited)	30 June 2021 (Unaudited)	31 March 2022 (Audited)
1.	Total Income from Operations	2,50,863.36	2,30,120.14	2,16,337.17	8,05,157.74	2,70,590.97	2,41,435.52	2,27,443.88	8,52,496.55
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	42,802.85	34,704.34	27,022.27	1,00,496.00	54,047.75	35,741.49	29,366.92	1,10,017.29
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	42,802.85	34,704.34	27,022.27	1,00,187.71	54,047.75	35,741.49	29,366.92	1,09,884.01
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	32,109.09	26,519.15	20,361.08	76,081.54	40,485.98	27,655.60	22,127.31	83,191.35
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	32,052.14	26,570.51	20,368.02	75,912.64	40,429.03	27,706.96	22,068.23	83,019.96
6.	Paid up Equity Share Capital	4,834.46	4,834.46	4,834.46	4,834.46	4,834.46	4,834.46	4,834.46	4,834.46
7.	Reserves (excluding Revaluation Reserve)				4,31,520.84				4,76,252.21
8,	Earnings Per Share (of Rs. 5/- each) (* not annualised) (for continuing and discontinued operations) - 1. Basic: 2. Diluted:	33.21 * 33.21 *	27.43 * 27.43 *	21.06 * 21.06 *	78.69 78.69	41.87 * 41.87 *	28.60 * 28.60 *	22.88 * 22.88 *	86.04 86.04
9	Net worth	4,59,017.34	4,26,429.25	3,75,321.52	4,26,429.25	5,12,125.60	4,71,160.62	4,14,705.78	4,71,160.62
10	Capital redemption reserve	550.16	550.16	550.16	550.16	550.16	550.16	550.16	550.16
	Debenture redemption reserve					13,405.09	10,997.87	950.00	10,997.87
	Debt Equity Ratio	0.23	0.26	0.38	0.26	1.04	1.11	1.20	1.11
13	Debt Service Coverage Ratio	2.30	2.21	2.79	1.88	1,81	1.34	1.95	1.38
14	Interest Service Coverage Ratio	19.64	14.39	9.70	10.08	6.91	4,89	3,77	3.93
15	Current Ratio	2.15	2.26	1.88	2.26	2,50	2.39	2.10	2.39
16	Long term debt to working capital	0.46	0.50	0.66	0.50	1.63	1.73	1,77	1.73
17	Bad debts to accounts receivable ratio	NIL	NIL	NIL	NIL	NIL	0.07	NIL	0.05
18	Current liability ratio	0.72	0.71	0.75	0.71	0.30	0.31	0.37	0.31
19	Total Debt to total assets	0.14	0.16	0.22	0.16	0.43	0.45	0.46	0.45
20	Debtor turnover ratio	6.86	6.47	6.87	6.44	1,66	1.57	1.68	1.49
	Inventory turnover ratio	4.61	4.61	3.86	3.56	4.61	4.61	3.79	3,56
	Operating margin (%)	19.64%	17,77%	16.19%	16.18%	25,52%	21.23%	20.77%	20.52%
23	Net profit margin (%)	12,96%	11.69%	9.54%	9.61%	15.04%	11.54%	9,77%	9.84%

Notes:

- The above is an extract of the detailed format of financial results for the quarter ended June 30, 2022 filed with the Stock Exchanges under Regulation 33 and 52(4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and Consolidated Financial Results for the quarter ended June 30, 2022 are available on the websites of the Stock Exchange (www.nseindia.com and www.bseindia.com) and the Company's website (www.grinfra.com).
- The above financial results for the quarter ended June 30, 2022 are as per the notified Indian Accounting Standards under the Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended. The above results including Report on Operating Segment have been reviewed by the Audit Committee and subsequently approved by the Board of Directors at their respective meetings held on August 9, 2022.
- As required under Regulation 33 and 52(4) of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Statutory Auditors have conducted a limited review of the above financial results for the quarter ended June 30, 2022.

For and on behalf of the Board of Directors G R Infraprojects Limited

> Vinod Kumar Agarwal Chairman and Wholetime Director

DIN: 00182893

Place : Gurugram Date : 09 August 2022



Sel/-

માટે ગુણવત્તાનું સર્ટિ મેળવવું પડશે

નવી દિલ્હી. તા. ૯

ઘઉંના લોટ, મેંદો અને રવો (સોજી)ના નિકાસકારોએ (આઉટબાઉન્ડ) બહારનાં ગુણવત્તા પ્રમાણપત્ર મેળવવું પડશે, એમ સરકારી જાહેરનામામાં જણાવવામાં ભલામણને આવ્યું હતું.

ગયા જુલાઇ મહિનામાં હતું. વાણિજ્ય મંત્રાલય હેઠળના ડિરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન કરેલાં શિપમેન્ટ્સની નિકાસ હતું. ટ્રેડ (ડીજીએફટી)એ જણાવ્યું માટે એકસપોર્ટ ઇન્સ્પેક્શન

2

3

4

5

6

accounting year

Diluted

Place: Ahmedabad

Date: 09/08/2022

લેવાની રહેશે.

હોલમીલ આટા અને રિઝલ્ટન્ટ મંજૂરી માટે રચવામાં આવેલી ઇન્ટર-મિનિસ્ટરીયલની

મંજૂર એમ આઇએમસીએ

કમિટિ ઇન્સ્પેક્શન એજન્સી) દ્વારા એવાં

Particulars

Net Profit / (Loss) for the period (before Tax and Exceptional items)

Net Profit / (Loss) for the period before Tax (After Exceptional items)

Reserve (excluding Revaluation Reserves) as per Balance sheet of previous

Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations) -

the requiremetns of SEBI's Circular dated 5th July, 2016, Ind AS and Schedule III [Division II] to the Companies Act, 2013.

Net Profit / (Loss) for the period after Tax (After Exceptional items)

Paid up Equity Share Capital (Face value of Rs.10 each)

Total Revenue from operations (net)

Total Comprehensive Income for the period

મંજૂરી ગુણવત્તાનું પ્રમાણપત્ર મેળવવું નિકાસની છુટ આપવામાં

આ ચીજોની ગુણવત્તાના સિસ્ટમમાં તેની નોંધણી થઇ સંદર્ભમાં જરૂરી પદ્ધતિઓ અંગે હોય. આધીન અલગથી જાહેરાત કરવામાં

જરૂરી બની રહેશે, એમ તેમાં આવશે, જેમાં જહાજ પરનું ઘઉંનો લોટ, મેંદો, રવો, જણાવવામાં આવ્યું હતું. લોડિંગ આ જાહેરનામા પહેલાં તેમાં જણાવાયું હતું કે, શરૂ થયું હોય અને જેમાં આટા જેવી ચીજો માટેની ટ્રાન્ઝીશનલ વ્યવસ્થાને લગતી કન્સાઇનમેન્ટ કસ્ટમ્સને (આ શિપમેન્ટસ માટે એક્સપોર્ટ નિકાસનીતિ મક્ત રહે છે. પણ જોગવાઇઓ આ જાહેરનામા જાહેરનામા પહેલાં) સોંપી ઇન્સ્પેક્શન કાઉન્સિલ પાસેથી નિકાસ ઘઉંની નિકાસની હેઠળ લાગપાત્ર રહેશે નહીં. દેવાયં હોય અને તેમની

> ૨૦૨૧-૨૨માં ભઆરતે રહેશે, એમ ડીજીએફટીએ કહ્યું આવશે. આ જાહેરનામું ૧૪ ૨૪૬.૫૭ મિલિયન ડોલરના ઓગસ્ટથી અમલી બનશે, મૃલ્યના ઘઉંના લોટની નિકાસ જણાવાયું કરી હતી.

મેમાં ભારતે હીટ વેવને વધુમાં, તેમાં ઉમેર્યા કારણે પાકને નુકસાન થયું હતું કે, ઉપરોક્ત કોમોડિટીના કાઉન્સિલ અથવા તેની દિલ્હી, અનુસાર, ૮ ઓગસ્ટથી હોવાની ચિંતાઓ વચ્ચે ઊંચા નિકાસકારોએ શિપમેન્ટ્સ મુંબઇ, ચેત્રઇ અને કોલકાતા ૧૪મી ઓગસ્ટ સુધીના ગાળા ભાવો પર નજર રાખવા ઘઉંની માટે ઘઉની નિકાસ પર ઇન્ટર- ખાતેની ઇઆઇએ (એક્સપોર્ટ દરમિયાન મેંદો અને રવાનાં નિકાસની મનાઇ ફરમાવી કન્સાઇનમેન્ટસને દીધી હતી.

CIN: L17100GJ1989PLC013041

Registered Office: Camex House, 2nd Floor, Stadium- Commerce Road, Navrangpura, Ahmedabad-380009.

Tel: +91-79-26462123 • Fax: +91-79-26462260 • Website: http://www.camexltd.com • Email: cs@camexltd.com

Year Ended

Audited

16343.38

187.36

507.58

422.39

6.93

4.21

1020.87

2667.21

Standalone

Unaudited

3651.43

-57.92

-57.92

-56.34

-0.55

-0.55

Quarter Ended

30/06/2022 | 31/03/2022 | 30/06/2021

Audited

4019.68

-66.95

253.28

210.36

6.93

2.13

2.13

1020.87

ઘઉંના લોટના નિકાસકર્તાએ નિકાસ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે કોવિડ રસી સર્ટિ. દૂર કરાય એવી શક્યતા

પીટીઆઇ નવી દિલ્હી, તા. ૯

સરકાર પેસેન્જ રોએ ભારત આવતાંપ હેલાં તેમનું કોરોના રસી સર્ટિફિકેટ કે આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ એર સુવિધા પોર્ટલ પર રિપોર્ટની જરૂરિયાત ધરાવતી અપલોડ કરવાનું રહે છે, એ

જોકે, પોર્ટલ પર સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મ ભરવાનો હાલનો અસુવિધાનો સામનો કરવો પડે છે, નિયમ જારી રહેશે, એમ સત્તાવાર એમ સૂત્રોએ કહ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું. પેસેન્જરો પોર્ટલ વારંવાર ડાઉન રહેતું સમયમાં જ મંજૂરી આપે, એવી હોવાની, ફોર્મ મેળવવામાં તથા શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી હતી. સર્ટિફિકેટ્સ અપલોડ કરવામાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદો મંત્રાલય

કરવાથી પેસેન્જરોને હાશકારો વિશે તેમની પાસેથી પ્રતિભાવો અંકુશો હળવા કર્યા છે. થશે. નાગરિક ઉજ્ઞ્યન મંત્રાલયે મેળવે છે. આંતરરાષ્ટ્રીય હવાઇ આંતરરાષ્ટ્રીય તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય મુસાફરી ફરી પાછી મહામારી ૧૨,૭૫૧ કેસનોંઘાયા હતા, આ મુસાફરોએ એર સુવિધા પોર્ટલ પર અગાઉના સ્તરે પરત ફરી રહી છે, સાથે દેશમાં કોરોનાના કેસોનો કુલ કોવિડ રસીકરણ સર્ટિફિકેટ કે ત્યારે ઘણા દેશોએ પ્રવાસની આંક ૪,૪૧,૭૪,૬૫૦ થયો આરટી-પીસીઆર નેગેટિવ સરળતા માટે જરૂરિયાતો અને હતો. જોગવાઇ દૂર કરવા માટે કેન્દ્રીય જોગવાઇ દૂર કરવા અંગે આરોગ્ય મંત્રાલયનો અભિપ્રાય સક્રિયપણે વિચારી રહી છે. માગ્યો હતો અને જણાવ્યું હતું કે, આ જોગવાઇને કારણે મુસાફરોએ

આરોગ્ય મંત્રાલય ટૂંક

ઉદ્ઘેખનીય છે કે, ઉડ્ડયન પ્રવાસ કરી હોવાનું જણાવતાં સૂત્રોએ સર્ટિફિકેટ્સ અપલોડ કરતી વખતે <u>ઉમેર્યું હતું કે, આ જોગવાઇ દૂર પ્રવાસીઓને</u> નડતી સમસ્યાઓ

Year Ended

31/03/2022

17981.67

86.69

406.91

318.31

1020.87

2695.74

3.19

3.19

6.93

(All Amounts in INR Lakhs, unless otherwise stated)

Unaudited

3712.6

-55.31

-55.31

-53.73

-0.53

Consolidated

Quarter Ended

Audited

5526.48

-68.14

252.08

208.63

1,020.87

6.93

2.11

2.11

For and on behalf of the Board

CAMEX LIMITED

Sd/-Chandraprakash Chopra

31/03/2022 | 30/06/2022 | 31/03/2022 | 30/06/2021

Unaudited

21.55

21.55

4.2

0.04

0.04

ભારતમાં કોરોનાના નવા

Barbeque-Nation Hospitality Limited



CIN: L55101KA2006PLC073031 Registered & Corporate Office: "Saket Callipolis", Unit No. 601 & 602, 6th Floor, Doddakannalli Village, Varthur Hobli, Sarjapur Road, Bengaluru-560035, Karnataka, India; Tel: +9180 69134900; E-mail: compliance@barbequenation.com; Website: www.barbequenation.com

16TH ANNUAL GENERAL MEETING OF **BARBEQUE-NATION HOSPITALITY LIMITED**

The 16 th Annual General Meeting (``AGM"') of Shareholders/Members of Barbeque-Nation Hospitality and the property of the prLimited ("Company") will be held on Tuesday, September 6, 2022 at 11:00 AM (IST) through Video Conference (VC) or Other Audio-Visual Means (OAVM) in compliance with the Circular Nos. 14/2020. 17/2020 39/2020 02/2021 02/2022 dated April 8 2020 April 13 2020 December 31 2020 January 13, 2021 and May 5, 2022 respectively and Circular No. 11 dated January 15, 2021 (hereinafter referred to as "Circulars") and all other circulars issued by the Ministry of Corporate Affairs (MCA), Government of India and Securities and Exchange Board of India (SEBI), to transact the business as set out in the Notice of the AGM.

In compliance with the aforesaid Circulars, electronic copies of the notice of the AGM along with the Annual Report for the financial year 2021-22 will be sent to those Members whose email addresses are registered with the Company/Depositories in accordance with the aforesaid MCA Circular and SEBI Circular dated May 13, 2022. Shareholders holding shares in dematerialized mode, are requested to register their email addresses and mobile numbers with their respective Depositories through their Denositary Participants. The Notice of 16th AGM and Annual Report for the financial year 2021-22 will also be made available on the Company's website at www.barbequenation.com, the Stock Exchanges where shares of the Company are listed viz., BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.comand www.nseindia.com, respectively and is also available on the website of CDSL (agency for providing the e-voting/remote e-voting service) at www.evotingindia.com.

Shareholders will have an opportunity to cast their vote remotely on the business as set forth in the Notice of the AGM through electronic voting system. Additionally, the Company is providing the $facility of voting through \, e\text{-}voting \, system \, during \, the \, AGM. \, The \, manner \, of \, casting \, remote \, e\text{-}voting \, and \, remote \, e\text{-}voting \, system \, during \, the \, AGM \, and \, remote \, e\text{-}voting \, system \, during \, the \, AGM \, and \, remote \, e\text{-}voting \, system \, during \, the \, AGM \, and \, remote \, e\text{-}voting \, system \, during \, the \, AGM \, and \, remote \, e\text{-}voting \, system \, during \, the \, AGM \, and \, remote \, e\text{-}voting \, system \, during \, the \, AGM \, and \, remote \, e\text{-}voting \, system \, during \, the \, AGM \, and \, remote \, e\text{-}voting \, system \, during \, the \, AGM \, and \, remote \, e\text{-}voting \, system \, sys$ e-Voting during the AGM by the shareholders procedure for and joining virtual meeting will be provided in the form of notes to Notice of the 16th AGM

. The Notice of 16th AGM along with the Annual Report for the financial year 2021-22 will be sent to the Shareholders in accordance with the applicable laws, to their registered email addresses in due

Place: Bengaluru

Ms. Nagamani CY Company Secretary & Compliance Officer

વેલકાસ્ટ સ્ટીલ્સ લિમિટેડ કોર્પોરેટ આઇડેન્ટિફિકેશન નં. : એલ૨૭૧૦૪૭જીજે૧૯૭૨પીએલસી૦૮૫૮૨૭ રજિસ્ટર્ડ ઓફિસ ઃ ૧૧૫-૧૧૬, જી.વી.એમ.એમ. એસ્ટેટ, ઓઢવ રોડ, અમદાવાદ-૩૮૨૪૧૫ વેબસાઇટ : www.welcaststeels.com ઇ-મેઇલ: info@welcaststeels.com ટે. નંબર : ૦૭૯-૨૨૯૦૧૦૭૮, ફ્રેક્સ : ૦૭૯-૨૨૯૦૧૦૭૭

૫૦મી વાર્ષિક સામાન્ય સભા અને ઇ-વોટિંગ માહિતીની નોટિસ

આથી નોટિસ આપવામાં આવે છે કે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના પરિપત્ર નં ૧૪/૨૦૨૦ તા. ૮મી એપ્રિલ, ૨૦૨૦, પરિષત્ર નં. ૧૭/૨૦૨૦ તા. ૧૩મી એપ્રિલ, ૨૦૨૦, પરિષત્ર નં. ૨૦/૨૦૨૦ તા. પમી મે, ૨૦૨૦, પરિષત્ર નં. ૦૨/૨૦૨૧ તા. ૧૩મી જાન્યુઆરી, ૨૦૨૧ અને પરિપત્ર નં. ૦૨/૨૦૨૨ તા. ૫મી મે, ૨૦૨૨ તથા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના પરપિત્ર નં. SEBI/ HO/CFD/CMD1/CIR/P/2020 /79 તા. ૧૨મી મે, ૨૦૨૦ પરિપત્ર નં. SEBI/HO/CFD/ CMD2/CIR/P/2021/11 તા. ૧૫મી જાન્યુઆરી, ૨૦૨૧ અને પરિપત્ર નં. SEBI/ HO /CFD / CMD2/CIR/P/2022/62 તાં. ૧૩મી મે. ૨૦૨૨ ('પરિપત્રો'), ને ધ્યાનમાં રાખતા, ૫૦મી વાર્ષિક સામાન્ય સભા સોમવાર, તારીખ પ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે વિડિઓ કોન્ફરન્સ (વીસી)/ અન્ય ઓડિયો વિડિઓ માધ્યમ (ઓએવીએમ) દ્વારા યોજાશે, જેમાં ૫૦મી વાર્ષિક સામાન્ય સભાની નોટિસમાં જણાવ્યા મુજબ સામાન્ય તથા ખાસ બિઝનેસ કરવા માટે યોજાશે.

વાર્ષિક સામાન્ય સભાની નોટિસ, વાર્ષિક રિપોર્ટ સાથે કે જેમાં ઇ-વોટિંગ અંગેની સૂચનાઓ પણ છે તે, દરેક સભાષદને કે જેના ઇ-મેઇલ આઇડી કંપની અથવા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ સાથે નોંધાયેલા હોય તેઓને ઇલેક્ટ્રોનિક માધ્યમ મારફત મોકલવામાં આવેલ છે. સભ્યોએ નોંધ લેવી કે વાર્ષિક સામાન્ય સભાની નોટિસ તથા વર્ષ ૨૦૨૧-૨૨ ના વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ - <u>www.welcaststeels.com,</u> સ્ટોક સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ, બીએસઇ લિમિટેડ કે જે www.bseindia.com તથા ઇ-વોટિંગની સુવિધા પુરી પાડના૨ સંસ્થા સેન્ટ્રલ ડિપોઝિટોરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ)ની વેબસાઇટ: www.evotingindia.com પરથી ડાઉનલોડ કરી શકાશે.

રિમોટ ઇ-વોટિંગ અને વાર્ષિક સામાન્ય સભા દરમિયાન ઇ-વોટિંગઃ

કંપની ધારા ૨૦૧૩ની કલમ ૧૦૮ની સાથે સુધારા સહિતના કંપની (મનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટેટિવ) રહ્ય ૨૦૧૪ ('નિયમ')ના નિયમ ૨૦ અને સેબી (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસક્લોઝર રિક્વાયરમેન્ટસ) રેગ્યુલેશન, ૨૦૧૫ના રેગ્યુલેશન ૪૪ મુજબ કંપની તેના સભાષદોને વાર્ષિક સામાન્ય સભાની નોટિસમાં જણાવ્યા બિઝનેસ માટે સી.ડી.એસ.એલ.ની રિમોટ ઇ-વોટિંગની સુવિધા આપે છે. રિમોટ ઇ-વોટિંગ ને વાર્ષિક સામાન્ય સભા દરમિયાન ઇ-વોટિંગ અંગેનની વિગતવાર સૂચનાઓ વાર્ષિક સામાન્ય સભાની નોટિસમાં આપેલ છે જે સભાષદોને મોકલી આપવામાં આવેલ છે.

કંપની ધારા ૨૦૧૩ અને તેના નિયમ અનુસાર નીચે મુજબ વિગતો આપવામાં આવે છે:

- ૧. ઇ-વોટિંગ માટે કટઓફ તારીખ સોમવાર, ૨૯ ઓગસ્ટ, ૨૦૨૨.
- ૨. રિમોટ ઇ-વોટિંગ શરૂ થવાની તારીખ અને સમયઃ ગુરુવાર, ૧ સપ્ટેમ્બર, ૨૦૨૨ની સવારે ૯.૦૦ કલાકે.
- ૩. રિમોટ ઇ-વોટિંગ સમાપ્ત થવાની તારીખ અને સમયઃ રવિવાર, ૪ સપ્ટેમબર, ૨૦૨૨ની સાંજે ૫.૦૦ કલાકે. આ તારીખ અને સમય પછી રિમોટ ઇ-વોટિંગ કરવાની પરવાનગી નથી. રિમોટ ઇ-વોટિંગ વિકલ્પનો ઉપયોગ ન કર્યો હોય અને જે સભ્યો વાર્ષિક સામાન્ય સભામાં વીસી/ઓએવીએમ દ્વારા હાજર રહ્યા હશે તે સભ્યો એજીએમમાં ઇલેક્ટોનિક સિસ્ટમ દ્વારા મત આપી શકશે. એકવાર સભ્યે ઠરાવ ઉપર રિમોટ ઇ-વોટિંગ દ્વારા મત આપી દીધો હોય તો તે વીસી/ઓએએમમાં ભાગ લઈ શકશે, પરંતુ તેમને વાર્ષિક સામાન્ય સભામાં ફરીથી મતદાન કરવાની મંજૂરી મળશે નહીં.
- ૪. જે વ્યક્તિએ કંપનીની વાર્ષિક સામાન્ય સભાની નોટિસ રવાના કર્યા બાદ કંપની શેર લીધા હોય અને કટ ઓફ તારીખ, (૨૯ ઓગસ્ટ, ૨૦૨૨)ના રોજ સભાષદ હોય તે વ્યક્તિ વાર્ષિક સામાન્ય સભાની નોટિસમાં જણાવેલ રિમોટ ઇ-વોટિંગની સૂચનાઓ અનુસરીને વોટિંગ કરી શકશે.
- ૫. જે વ્યક્તિનું નામ સભાષદ રજીસ્ટરમાં અથવા ડિપોટરી પાર્ટિસિપન્ટસના બેનીફિસીઅલ ઓનર્સ રજીસ્ટરમાં કટઓફ તારીખે નોંધાયેલ હોય તે વ્યક્તિ વાર્ષિક સામાન્ય સભામાં હાજર રહી શકશે તેમજ રિમોટ ઇ-વોટિંગ દ્વારા મતદાન કરી શકશે.
- ૬. સભ્યોએ ઇલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ થકી વાર્ષિક સામાન્ય સભાની નોટિસમાં દર્શાવ્યા મુજબના કામાકાજ પર મત આપવાની તક મળશે. ડીમેટ સ્વરૂપમાં, ફિઝિકલ સ્વરૂપમાં શેરો ધરાવતા સભ્યો અને જેમના ઇ-મેઇલ આઇડી નોંધાયા નથી તેવા સભ્યો માટે વોટિંગ સમય દરમિયાન અને વાર્ષિક સામાન્ય સભા દરમિયાન ઇલેક્ટ્રોનિક મતદાન આપવાની પત્રતિ નોટિસમાં આપવામાં આવેલ છે.
- ૭. જે સભ્યોએ પોતાના ઇ-મેઇલ આઇડી કંપની / ડિપોઝિટોરી પાર્ટિસિપન્ટસ પાસે નોંધાવેલ નથી, તેઓએ વાર્ષિક અહેવાલ મેળવવા તેમજ સૂચનાઓ સહિતના તમામ સંદેશા પ્રાપ્ત કરવા માટે નીચે દર્શાવ્યા મુજબ ઇ-મેઇલ આઇડી નોંધાવવાનું રહેશે.

એ. ફિઝિકલ સ્વરૂપે શેર ધરાવતા હોય તે સભ્યોને વિનંતી છે કે તમારા ઇ-મેઇલ આઇડી અને મોબાઇલ નંબર ફોર્મ ISR - ૧ અને ફોર્મ ISR - ૨ માં ભરી શકે છે કે જે કંપનીની વેબસાઇટ http://www.welcaststeels.com/newsite/Shareholderservicekyc.html તેમજ રજિસ્ટ્રાર અને શેર ટ્રાન્સફર એજન્ટ (આઇટીએ)ની https://www.bigshareonline.com/Resources.aspx પર પ્રાપ્ય છે.

બી. જે સભ્યો ડિમેટ સ્વરૂપમાં શેર ધારણ કરી રહ્યા છે તેઓ પોતાના ડિપોઝિટોરી પાર્ટિસિપન્ટ પાસે નોંધાવી શકે છે.

- ૮. ઇ-વોટિંગ સંબંધી કોઈ પણ પ્રશ્ન હોય, તો સભ્યો તે માટે www.evotingindia.com ઉપ૨ ુ હેલ્પ સેકશનમાં ફીક્વન્સલી આસ્કડ ક્વેશ્ચન્સ - FAQ[,] (અવાર નવાર પુછાતા પ્રશ્નો) અને ઇ-વોટિંગ મેન્યુઅલનો ઉપયોગ કરી શકે છે અથવા helpdesk@evotingindia.com પર ઇ-મેઇલ કરી શકે છે ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૨૫૫૩૩ પર ફ્રોન કરીને જાણકારી મેળવી શકે છે.
- ૯. ઇ-વોટિંગ ને લગતી કોઈ પણ ફરિયાદ હોય તો, શ્રી રાકેશ દળવી, સિ. મેનેજર, સેન્ટ્રલ ડિપોઝિટોરી સર્વિસીસ (ઇન્ડિયા) લિમિટેડ, એ વિન્ગ, ૨૫મો માળ, મેરેથોન ફ્યુચુરેક્ષ, મફતલાલ મિલ્સ કમ્પાઉન્ડ, એન એમ જોશી માર્ગ, લોઅર પરેલ (પૂર્વ), મુંબઈ - ૪૦૦ ૦૧૩ નો સંપર્ક ઇ-મેઇલઃ helpdesk@evotingindia.com પર ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૨ ૫૫ ૩૩ ૫૨ ફોન કરીને જાણકારી મેળવી શકે છે.

વેલકાસ્ટ સ્ટીલ્સ લિમિટેડ વતી.

કંપની સેક્રેટરી

તારીખ ઃ ૯ ઓગસ્ટ. ૨૦૨૨ એસ.એન. જેથલિયા સ્થળ : અમદાવાદ

Requirements) Regulations, 2015. The full format of the Standalone and Consolidated Unaudited Financial Results is available on the websites of the Stock Exchanges, www.bseindia.com and on the Company website www.camexltd.com

2. The above unaudited results for the quarter ended on June 30, 2022 has been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS), prescribed under Section 133 of the Companies Act, 2013, and other

3. The above is an extract of the detailed format of Standalone and Consolidated Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure

recognised accounting practices and policies to the extent applicable. The format of the audited quarterly and year-to-date results as prescribed in SEBI's Circular CIR/CFD/CMD/15/2015 dated 30th November, 2015 has been modified to comply with

Extract of Standalone and Consolidated Unaudited Financial Results for the Quarter ended June 30, 2022

Unaudited

3099.12

68.43

68.43

51.08

1020.87

Managing Director (DIN:00375421)



G R INFRAPROJECTS LIMITED

Registered Office: Revenue Block No.223, Old survey No. 384/1, 384/2, Paiki and 384/3, Khata No.464, Kochariya, Ahmedabad, Gujarat - 382220 Corporate Office: 2nd Floor, Novus Tower, Plot No. 18, Sector -18, Gurugram, Haryana- 122015 CIN: L45201GJ1995PLC098652, Ph: +91 124-6435000

Website: www.grinfra.com, Email: cs@grinfra.com EXTRACT OF THE STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED JUNE 30, 2022

1. These financial results were reviewed by the Audit Committee, and were approved by the Board of Directors and taken on record by the Board of Directors at their meeting held on August 9, 2022.

SI.		Standalone				(Rupees in lakhs, except per share data) Consolidated			
No.		Quarter ended			Year ended	Quarter ended			Year ended
		30 June 2022	31 Mar 2022	30 June 2021	31 March 2022	30 June 2022	31 Mar 2022	30 June 2021	31 March 2022
		(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)
1.	Total Income from Operations	2,50,863.36	2,30,120.14	2,16,337.17	8,05,157.74	2,70,590.97	2,41,435.52	2,27,443.88	8,52,496.55
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	42,802.85	34,704.34	27,022.27	1,00,496.00	54,047.75	35,741.49	29,366.92	1,10,017.29
3.	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items)	42,802.85	34,704.34	27,022.27	1,00,187.71	54,047.75	35,741.49	29,366.92	1,09,884.01
4.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	32,109.09	26,519.15	20,361.08	76,081.54	40,485.98	27,655.60	22,127.31	83,191.35
5.	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	32,052.14	26,570.51	20,308.02	75,912.64	40,429.03	27,706.96	22,068.23	83,019.96
6.	Paid up Equity Share Capital	4,834.46	4,834.46	4,834.46	4,834.46	4,834.46	4,834.46	4,834.46	4,834.46
7.	Reserves (excluding Revaluation Reserve)	, imposes i	7//-12-03-03-29		4,31,520.84	-man-societi- = 1			4,76,252.21
8.	Earnings Per Share (of Rs. 5/- each) (* not annualised) (for continuing and discontinued operations) -								
	1. Basic:	33.21 *	27.43 *	21.06 *	78.69	41.87 *	28.60 *	22.88 *	86.04
	2. Diluted:	33.21 *	27.43 *	21.06 *	78.69	41.87 *	28.60 *	22.88 *	86.04
9	Net worth	4,59,017.34	4,26,429.25	3,75,321.52	4,26,429.25	5,12,125.60	4,71,160.62	4,14,705.78	4,71,160.62
10	Capital redemption reserve	550.16	550.16	550.16	550.16	550.16	550.16	550.16	550.16
11	Debenture redemption reserve	87.				13,405.09	10,997.87	950.00	10,997.87
12	Debt Equity Ratio	0.23	0.26	0.38	0.26	1.04	1.11	1.20	1.11
13	Debt Service Coverage Ratio	2.30	2.21	2.79	1.88	1.81	1.34	1.95	1.38
14	Interest Service Coverage Ratio	19.64	14.39	9.70	10.08	6.91	4.89	3.77	3.93
15	Current Ratio	2.15	2.26	1.88	2.26	2.50	2.39	2.10	2.39
16	Long term debt to working capital	0.46	0.50	0.66	0.50	1.63	1.73	1.77	1.73
17	Bad debts to accounts receivable ratio	NIL	NIL	NIL	NIL	NIL	0.07	NIL	0.05
18	Current liability ratio	0.72	0.71	0.75	0.71	0.30	0.31	0.37	0.31
19	Total Debt to total assets	0.14	0.16	0.22	0.16	0.43	0.45	0.46	0.45
20	Debtor turnover ratio	6.86	6.47	6.87	6.44	1.66	1.57	1.68	1.49
21	Inventory turnover ratio	4.61	4.61	3.86	3.56	4.61	4.61	3.79	3.56
22	Operating margin (%)	19.64%	17.77%	16.19%	16.18%	25.52%	21.23%	20.77%	20.52%
23	Net profit margin (%)	12.96%	11.69%	9.54%	9.61%	15.04%	11.54%	9.77%	9.84%

Notes:

- The above is an extract of the detailed format of financial results for the quarter ended June 30, 2022 filed with the Stock Exchanges under Regulation 33 and 52(4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and Consolidated Financial Results for the quarter ended June 30, 2022 are available on the websites of the Stock Exchange (www.nseindia.com and www.bseindia.com) and the Company's website (www.grinfra.com).
- The above financial results for the quarter ended June 30, 2022 are as per the notified Indian Accounting Standards under the Companies (Indian Accounting Standards) Rules, 2015 as amended. The above results including Report on Operating Segment have been reviewed by the Audit Committee and subsequently approved by the Board of Directors at their respective meetings held on August 9, 2022.
- 3. As required under Regulation 33 and 52(4) of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Statutory Auditors have conducted a limited review of the above financial results for the

G R Infraprojects Limited Vinod Kumar Agarwal Chairman and Wholetime Director

DIN: 00182893

For and on behalf of the Board of Directors

Place: Gurugram

Date: 09 August 2022